

પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી
કેન્દ્રીય પ્રવેશ સમિતિ પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમાં પ્રવેશ સને ૨૦૧૯-૨૦ ના
પ્રથમ વર્ષ પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમાં (D.El.Ed) (પી.ટી.સી.)
પ્રવેશ અંગેની સુધારા જાહેરાત

રાજ્યમાં આવેલ એન.સી.ટી.ઇ. દ્વારા માન્યતા પ્રાપ્ત સરકારી / બિન સરકારી, અનુદાનિત, તેમજ સ્વનિર્ભર અધ્યાપન મંદિરો / જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોમાં કેન્દ્રીયકૃત પ્રવેશ યોજના હેઠળ વર્ષ ૨૦૧૯-૨૦ માં ગુજરાતી/હિન્દી/ઉર્દુ/મરાઠી અને અંગ્રેજી માધ્યમના પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમાં બે વર્ષના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઇન એપ્લિકેશન વેબસાઇટ <https://deled.orggujarat.com> પર તા.૨૭/૬/૨૦૧૯ સવારના ૧૦-૦૦ કલાક થી તા.૦૬/૦૭/૨૦૧૯ રાત્રીના ૨૩.૫૯ કલાક સુધી મંગાવવામાં આવે છે. ઓનલાઇન ફોર્મની હાર્ડ કોપી સ્વિકાર કેન્દ્ર પર જમા કરાવી જરૂરી ફી ભરી પહોંચ મેળવી લેવાની રહેશે. નકકી કરેલ સ્વીકાર કેન્દ્રોની યાદી જિલ્લાવાર વેબસાઇટ <https://deled.orggujarat.com> પર મુકવામાં આવેલ છે. ફોર્મ ભરવા સંબંધી અન્ય સુચનાઓ વેબસાઇટ પર મુકેલ છે. જે ધ્યાને લઇ, ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.

સ્વનિર્ભર સંસ્થાઓએ તેમની મેનેજમેન્ટ ક્વોટાની ૧૫ ટકા સીટો શિક્ષણ વિભાગના તા.૫/૭/૨૦૧૯ના ઠરાવ મુજબ ભરવાની રહેશે. મેનેજમેન્ટ ક્વોટાની સીટો ભરવા અંગેની સુચનાઓ હવે પછી અલગ પત્ર તથા વેબસાઇટ પરથી જાણ કરવામાં આવશે.

- (૧) પ્રવેશ માટે જરૂરી લાયકાત:- ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા (ધોરણ-૧૨) વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી અને ઉત્તર બુનિયાદી પ્રવાહમાં પ્રાયોગિક વિષય સહિતના કુલ ગુણ માંથી ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ સાથે ઉત્તિષ્ઠ કરેલ હોવી જોઈએ.
- (૨) પ્રવેશ માટે લઘુત્તમ ગુણ:- ઉમેદવારે નિયત કરેલ પ્રવાહોની પરીક્ષામાં કુલ ગુણમાંથી ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ. પરંતુ અનામત કક્ષાના ઉમેદવારો અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તથા આર્થિક રીતે નબળા વર્ગના (EWS) ઉમેદવારે ઓછામાં ઓછા ૪૫ ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ.
- (૩) પ્રવેશનું માધ્યમ:- ઉમેદવારે જે માધ્યમમાં ધોરણ-૧૦ ની પરીક્ષા પાસ કરેલ હશે તે જ માધ્યમની કોલેજમાં પ્રવેશને પાત્ર રહેશે.
- (૪) વયમર્યાદા:- જે ઉમેદવારો તા.૦૧/૦૭/૨૦૧૯ ના રોજ ૨૪ વર્ષથી વધુ ઉંમરના ન હોય તેવા તમામ ઉમેદવારો પ્રવેશપાત્ર ગણાશે અનુસૂચિત જાતિ / અનુસુચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (બક્ષીપંચના) તથા આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે ઉંમરમાં ૫ વર્ષની છૂટછાટ રહેશે. ૩૩ વર્ષ સુધીના વિધવા બહેનો પ્રવેશને પાત્ર રહેશે.
- (૫) શિક્ષણ વિભાગના તા.૧૯/૦૮/૨૦૧૭ ના ઠરાવની જોગવાઈ મુજબ તમામ પ્રકારના દિવ્યાંગ ઉમેદવારો માટે ૫ % અનામત મળવાપાત્ર થશે.

રાજ્યમાં આવેલ એન.સી.ટી.ઇ. માન્યતા પ્રાપ્ત તમામ સંસ્થાઓને તથા ઉમેદવારોને પ્રવેશ સંબંધી જરૂરી સૂચનાઓ યથાપ્રસંગે વેબસાઇટ પર મુકવામાં આવશે. તે વખતો-વખત જોવા વિનંતી કરવામાં આવે છે.

તારીખ:-૨૬/૬/૨૦૧૯
ગાંધીનગર.

(ડૉ.એમ. આઇ જોષી)